



શું પ્રતિજ્ઞા એ બંધન છે ?

— મુનિ શ્રી મહાદ્વારાગરજી ‘ગુણુઆલ’

[“પ્રતિજ્ઞા (નિયમ) લઈએ અને તૂં જય એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી” ધર્ત્યાદિ ઐતિહાસિક આટલું તો જરૂર વિચારે.]

આજે ઘણું આત્માએ “પ્રતિજ્ઞા (નિયમ) લેવાની શી જરૂર છે?” “અમે તો પ્રતિજ્ઞા લીધા વિના જ અસુક રીતે વત્તીશું, પરંતુ પ્રતિજ્ઞા તો નહિ લઈએ !” “પ્રતિજ્ઞા એ તો બંધન છે !” “પ્રતિજ્ઞા લઈએ અને પછી ભાંગી જય એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી” ધર્ત્યાદિ માનતા, ઐતિહાસિક પ્રચારતા જેવા મળે છે.

તેઓએ આટલું જરૂર વિચારલું ઘટે કે, જેમ વ્યવહારમાં પણ રેઝિયો કે ટી. વી. વગેરે મનોરંજનનાં સાધનો ધરમાં વસાયા પછી કહાય ૧૨ મહિના સુધી તેનો ઉપયોગ જિવકુલ ન થાય તો પણ જે લાયસન્સ રહ ન કરાયું હોય તો ૧૨ મહિનાને અંતે તેનો ટેક્ષ ભરવો જ પડે છે. મકાન ભાડે લીધા પછી સંયોગવશાત્ તેનો ઉપયોગ ન કરી શકવા છતાં પણ મકાન વિધિપૂર્વક પાછું સુપ્રત ન કર્યું હોય તો તેનું ભાડું ભરવું જ પડે છે. તેવી જ રીતે દુનિયામાં થઈ રહેતાં અગણિત પાણોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી, ગમે તે પણ ગમે તે પાપ કરી નાખવાની શક્યતા ખુલ્લી રહેતી હોવાથી તે પાપ ન કરવા છતાં પણ તે નિમિત્તે કર્મબંધ ચાલુ જ રહે છે. માટે જ તો નિગોદ (અનંતકાય-અનંત લુલોનું એક જ સૂક્ષ્મ શરીર)ના લુલો હિંસા, અસત્ય, ચોરી, મૈથુન જેવાં કોઈ પણ પ્રકારનાં વ્યક્ત (સ્પષ્ટ) પાપો ન કરતા હોવા છતાં પણ પ્રતિજ્ઞા-પૂર્વક પાણોના ત્યાગના અભાવ (અવિરતિ)થી થતા કર્મના આશ્રયથી તેઓને અનંતકાળ સુધી નરક કરતાં પણ અનંતગણું હુંઓવાળી નિગોદમાં જનમ-મરણ કરવાં પડે છે; વળી પૃથ્વીકાય આહિ એકેન્દ્રિય લુલો મુખ ન હોવાથી કવલાહાર (મુખ દ્વારા કોળિયા રૂપે આહાર અહુણું કરવો તે) કરી શકતા નથી. તેમ છતાં પણ પ્રતિજ્ઞા (વિરતિ)ના અભાવે

શ્રી આર્ય કષ્ટયાણ ગોતમ સમૃતિ ગ્રંથ

ઉપવાસનું પુણ્ય પામી શકતા નથી અને અસંખ્ય વર્ષો ચુધી તેમને એકેન્દ્રિય ચૈનિયોમાં જ જન્મમરણ કરવા પડે છે. માટે અવિરતિ (પાપો ન કરવાની પ્રતિજ્ઞાના અભાવ) થી થતા નિર્થેક કર્મબંધથી બચવા માટે પ્રતિજ્ઞા એ ખૂબ જ જરૂરી છે.

વળી કેટલાક લુંગો એમ પણ કહે છે કે “ અમૃત પાપન કરવું એ જાતની પ્રતિજ્ઞા દેવાથી જિલ્લાનું મન તે વાતનો જ વારંવાર વિચાર કરવા માંડે છે, માટે પ્રતિજ્ઞા દેવી નહિં.” આ વાત પણ બરાબર નથી. કારણ કે શરૂઆતમાં કદાચ પૂર્વના સંસ્કારશાસ્ત્ર તેમ થાય તો પણ જે તે પાપના તુકસાન સમજવાપૂર્વક તેમ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તો ધીરે ધીરે મન ટેવાઈ જય છે કે, મારે તો અમૃત કામ ન કરવાની પ્રતિજ્ઞા જ છે, એટલે મારે એ બાબતનો વિચાર કરવો પણ વ્યર્થ છે. ઉપવાસનું મહત્વ સમજવાપૂર્વક તેનું પચ્ચયક્રમાણ લીધા પડી ગમે તેવી સુંદર રસવતી સામે આવે તો પણ “ મારે તો આજે ઉપવાસની પ્રતિજ્ઞા છે.” એવા જ્યાદાથી પ્રાય: કરીને તે સુંદર રસવતીને ખાવાનું કે તેનો વિચાર કરવાનું પણ મન થતું નથી. આ અનુભવસિદ્ધ હકીકત છે. આ તો થઈ નિષેધાત્મક નિયમની વાત.

વળી કરવા યોગ્ય સુંદર અનુષ્ઠાનો માટે પણ “ હું આમ જરૂર કરીશ.” આવી પ્રતિજ્ઞા લીધી ન હોય પણ ઈક્તા સંકલ્પ જ કર્યો હોય તો આપણું મન સામાન્ય નિમિત્તો મળતાં જ તરત એ શુભ સંકલ્પથી ચલિત થઈ જય છે. દા. ત. દસરોજ પ્રભુદર્શન કરવાનો માત્ર સંકલ્પ (પ્રતિજ્ઞા નહિં) કર્યો હોય તો થોડું પણ વ્યાવહારિક કાર્ય આવી પડતાં તરત જ મન નથળું પડી જાય છે કે ‘આજે તો અમૃત પ્રકારના સંયોગો હોવાથી તારાથી દર્શન થઈ શકશે નહિં. કાલથી જરૂર કરીશ. આજે એક દિવસ દર્શન ન થાય તો શું ખાદુંમેળું થઈ જવાનું હતું !’ પણ જે પ્રભુદર્શન કરવાની પ્રતિજ્ઞા જ લીધી હોય તો ‘ મારે તો સવારના સુખમાં કાંઈ પણ નાખતાં પહેલાં પ્રભુદર્શન કરવાની પ્રતિજ્ઞા છે, માટે મારે તેનું પાલન કરવું જ જોઈ એ.’ આવા વિચારથી એ શુભ અનુષ્ઠાનમાં નિયમિતતા જળવાઈ રહે છે. માટે વિષેયાત્મક બાળતોની પણ પ્રતિજ્ઞા (નિયમ) જરૂર દેવી જોઈ એ.

વળી પ્રતિજ્ઞાને બંધન માનતારાએ એટલું જરૂર વિચારવું જોઈ એ કે, જેમ મોટર, રેલવે, વિમાન વગેરેને એક હોય, ઘોડા-અળદ વગેરેને લગામ હોય, સસુર-નહીને કાંડાની મર્યાદા હોય તો જ તેઓ ઉપયોગી બની રહે છે. પરંતુ એક વગરની મોટર, રેલવે, વિમાન તથા લગામ વગરના ઘોડા-અળદ વગેરે તેમ જ કાંડા વગરના સસુર-નહીની અનેક હોનારતો સર્જય છે, તેવી જ રીતે જીવનમાં પણ ઇન્દ્રિયો અને મન ઉપર પ્રતિજ્ઞા-



નિયમ ડ્રેપી એક-વગામ કે મર્યાદા હોય તો જ તે લુચન પોતાને અને ખીજન પણ અનેકોને ઉપયોગી બની શકે છે. પરંતુ નિયમ વગરનું નિરંકૃશ લુચન તો અનાદિકાળના વિષય-કૃષ્ણોના કુસંસ્કારોને કારણે સ્વ-પરને અનેક રીતે અલિશાપ ડ્રેપ (નુકસાનકારક) બની રહે તો પણ નવાઈ નહિ. માટે ટૂંકમાં પ્રતિજ્ઞા એ બંધન નથી, પણ જીલદું રાગ-દ્રેપની વાસનાઓના અને વિષય-કૃષ્ણાના કુસંસ્કારોનાં બંધનોથી આત્માને છોડવવા માટે તીક્ષ્ણ અસિધારા (તલવારની ધાર)નું કામ કરે છે. પ્રતિજ્ઞા એ તો પ્રમાદરૂપી શરૂનો બાણુવૃષ્ટિથી આત્માનું રક્ષણ કરવા માટેનું ભજણૂત કવચ છે, બધતર છે. આવી પ્રતિજ્ઞાને બંધન માનવું એ તો ખરેખર નરી આત્મવંચના જ છે.

બ્રવહૃરમાં પણ વેપારના અને સ્કૂલ-કોલેજોના, હોટલો અને સિનેમા-ટોકિઓના, કલણો અને લુભાનાંઓના, રેલવે અને અસોના, ટ્યાલખાતા અને ઐન્કોના, કોર્ટ-ક્રેરીઓ અને મ્યુનિસિપાલિટીના, રેશનિંગ અને ફ્રેંચ ઉન્ડોના, મંડળો અને સોસાયટીઓના અનેક નિયમોને ડગલે પગલે આધીન રહી લુચન લુચનારો માનવી માત્ર ધાર્મિક નિયમોને જ બંધન ડ્રેપ કહી તેની ઉપેક્ષા કરે તો એવા એ લારેકમી માનવીની માત્ર લાવ-હ્યા ચિંતવવા સિવાય પણ શું હોઈ શકે ?

વળી “પ્રતિજ્ઞા લઈએ અને લાંઘી જય તો ?” એમ કહેનારા ‘મૂળા પહેલાં જ મોકાણુ’ માંડે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં જ લાંઘી જવાની વાત કરનારાએ “રોતો જય એ મૂળાની જ ખરેર લાવે.” એ કોકોકિતને ચરિતાર્થ કરનારા છે, પરંતુ તેઓ સાંસારિક કાર્યોમાં આવું કશું જ વિચારતા નથી કે ‘ ખેનમાં એસી હૈરેન (પરદેશ) જાઉં તો છું પણ અધવચ્ચે જ વિમાન સણળી જશે તો...?’ ‘હુલરો ઇપિયા અચ્ચિને ડેકટર, વડીલ કે એન્જિનિયર આદિની ડિચ્ચીએ પ્રાપ્ત કરવા માટે લાણું છું તો ખરો પણ તે ડીચ્ચીએ મજયા પછી હું તરત જ મરી જાઉં તો મારા બધા જ પૈસા અને સંધળી એ મહેનત નકામી તો નહિ જય ને...?’ ‘મકાન તો બંધાવું છું પણ ધરતીકંપના આંચકાથી પડી જશે તો...?’ ‘કડાન તો ખોલું છું પણ દેવળું નીકળશે તો...?’ ‘હીકરી પરણાવું તો છું પણ થોડા જ વખતમાં રંડાપો આવશે તો...?’ ‘સ્વીને પરણું તો છું પણ થોડા જ વખતમાં મરી જય અને બધો ખર્ચ નકામો જય તો...?’

ઉપરોક્ત બધા જ પ્રસંગોમાં એ આવી રીતે ભવિષ્યના નુકસાનના વિકલ્પો કરવામાં આવે તો સાંસારનું એક પણ કાર્ય બની શકે નહિ.

‘વેપારમાં નુકસાની આવશે તો ?’ એવી શાંકાથી વેપારને જ નહિ કરનારો ધન પ્રાપ્તિના લાભને મેળવી શકતો નથી. મરી જવાના જયથી જે લાણું જ નથી તે

શ્રી યાર્ય કટ્યાણ ગૌતમ સ્મृતિ ગંધી

જિંદગીના અભાણ રહી જય છે. તેવી જ રીતે 'પ્રતિજ્ઞા લઇ અને ભાંગી જય તો ?' એવી ઓટી આશાંકાથી પ્રતિજ્ઞા નહિ લેનારો. પ્રતિજ્ઞાથી (પાપોના અટકાવવારૂપ) થતા લાસથી સહાને માટે વંચિત રહી જય છે, અને આ ચંચળ મનુષ્યભસવતું ક્ષણુભસવતું આયુષ્ય પૂર્ણ થતાં હુર્ગતિમાં ધકેલાઈ જય છે. માટે પ્રત્યેક સુજ પુરુષોએ ઉપરોક્ત પ્રકારના માનસિક કુબિકલ્પોને હુર કરી, પ્રતિજ્ઞાથી થતા લાસોનો વિચાર કરી થથાસ્ક્રિત પ્રતિજ્ઞા સ્વીકારી તેનું સુંદર રીતે પાલન કરવા માટે તત્પર રહેવું જોઈ છે. એમ ઘરમાં ઉપરના માણે ચડવા માટે રાખેલી નીસરણી ઉપરથી પગ લયસતાં કોઈ પડી જય તો પણ નીસરણી કાઢી નાખાતી નથી; પરંતુ પડવાથી થયેલ જણમને ઝાંખવા માટે મલમપદ્ધી કરવી બીજી વાર નીસરણી પર ચડતી વખતે વધારે સાવધાની રાખવામાં આવે છે.

તેવી જ રીતે, સુંદર રીતે પાલન કરવાના શુદ્ધ ધરાદાપૂર્વક લીધેલી કોઈ પણ પ્રતિજ્ઞાનો કદાચ કચારેક કોઈ તીવ્રતમ અશુદ્ધ કર્મના ઉદ્યથી કે શરતચૂકથી ભાંગ પણ થઈ જય તો પણ તરત શુરૂમહારાજને નિખાલસતાપૂર્વક જણાવી પ્રાયસ્ક્રિત સ્વીકારી શુદ્ધ બની ફરીથી વધારે સાવધાનીપૂર્વક તે પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પુરુષપદ્ધ કરવો જોઈ છે.

પરંતુ તૂટી જવાના ધરાદાથી પ્રતિજ્ઞાને જ નહીં સ્વીકારનારો માણુસ ખરેખર કબજીયાતના લયથી લોજન ત્યાગ કરનારની પેઠે કે જૂ-લીણ પડવાના લયથી કપડાને જ શરીર પર નહીં પહેરનારની પેઠે હાસ્યાસ્પદ જ ગણ્યાયને ?

વળી કેટલાક આત્માચો અદ્યાત્મની કોરી વાતો કરી કહેવાતી ધ્યાન અને યોગની પ્રક્રિયાઓને કે કેવળ પ્રાર્થનાને જ વધારે પડતું મહુત્વ આપી વત-પર્યાજણાણ તરફ અરુચિ દર્શાવે છે.

વત નહીં પર્યાજણાણ નહિ, નહિ ત્યાગ કોઈ વસ્તુનો;

મહાપત્ર તીર્થ્યકર થશે, શ્રેણીક ઢાણુંગ જોઈ લો.

ઈત્યાદિ કોઈ અપેક્ષાથી કહેવાયેલાં ઉપરોક્ત પ્રકારના વાક્યોને આગળ ધરી, શ્રેણીક આહિનાં દ્યટાંત આપી કહે છે કે, “શ્રેણીક મહારાજને કોઈ પણ વસ્તુનો ત્યાગ ન હોવા છતાં તેઓ પરમાત્મા શ્રી મહાવીરદેવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાસ્ક્રિતના પ્રતાપે આવતી ચોવીસીમાં પરનાલ નામે તીર્થ્યકર થશે. ઢાણુંગ નામે ત્રીજુ અંગસૂત્ર આ વાતની સાથી પૂરે છે, માટે પર્યાજણાણ લેવાની કોઈ જરૂર નથી.”

તે આત્માચો જરૂર વિચારણ પડે કે, ઉપરોક્ત શ્રેણીક કેવળ લક્ષિતયોગતું માહાત્મ્ય વર્ણનવા માટે જ કહેવાયું છે, નહીં કે વત-પર્યાજણાણનો નિષેધ કરવા કે



અપેક્ષા કરવા... વળી શેખિક મહારાજ પૂર્વે બાંધેલાં તથા વિવિધ પ્રકારનાં નિકાચિત અપ્રત્યાગ્યાની કષાય મોહનીય કર્મના ઉદ્ઘયથી બ્રત-પરચચભાણુ લઈ શકતા નહોતાં કે કોઈ પણ વસ્તુનો લાગ કરી શકતા નહોતા, પરંતુ તેમના હૃદયમાં તો વિરતિ (પ્રતિજ્ઞા) ધર્મનો અને વિરતિધરે પ્રત્યે ભારેભાર બહુમાન હતું. જરા પણ અરુચિ કે ઉપેક્ષા ન હતી અને પોતે પ્રતિજ્ઞા ન લઈ શકવા બદલ તેમના અંતરમાં ખૂબ જ પશ્ચાત્તાપ રહ્યા કરતો હોએ. તેથી જ તે પ્રતિજ્ઞા પ્રયેના સાપેક્ષમાનપૂર્વક પરમાત્મભક્તિના પ્રતાપે તીર્થંકર થવાના છે; નહિ કે બ્રત-પરચચભાણુ પ્રત્યેની ઉપેક્ષા હોવા છતાં પણ.

વળી તે જ ભવમાં અવશ્ય કેવળજ્ઞાન પામી તીર્થંકર બની મોક્ષે જનાર અને પદ્ધતથી અવસ્થામાં પણ મોટે ભાગે સતત આત્મક્યાનમાં લીન રહેનારા એવા અરમ તીર્થપતિ શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પણ જે જગતપ્રસિદ્ધ મહાપ્રતિજ્ઞા લીધી હતી, અને જેના પ્રલાયે પાંચ (૫) મહિના અને પચચીસ (૨૫) દિવસના ઉપવાસના અંતે પ્રતિજ્ઞાની બધી શરતો પૂર્ણ થવાથી ચંદ્રનભાગાના હાથે તેમનું પારણું થયું હતું, એવાત પણ ધ્યાન આદિની વાતો કરી બ્રત-પરચચભાણુની ઉપેક્ષા કરનારા આત્માચોચે ખાસ વિચારવા જેવી છે. વળી દરેક તીર્થંકર ભગવંતોને હીક્ષા લેતી વખતે ‘કરિમે સામાધ્ય’ ઈત્યાદિ ચાવનજીવ સામાચિક ભીજું પ્રતિજ્ઞાના ઉચ્ચાર કરતાંની સાથે જ પરમ વિશુદ્ધ અધ્યવસાચો થવાથી અચ્યાત નિર્મણ એવું મનઃપર્યવ નામે ચોથું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ બાબત પણ પ્રતિજ્ઞાની મહત્તમ સમજવવા પૂરતી નથી શું ?

દરેક આત્માચો આ લેખ મનનપૂર્વક વાંચી, વિચારી પ્રતિજ્ઞા કે નિયમ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાચોને મગજમાંની દેશવટો આપોને વિધેયાત્મક અને નિષેધાત્મક નિયમોમાંથી ચથાશક્તિ નિયમોનો સ્વીકાર કરી તેનું સુંદર રીતે પાલન કરી દેવ-હુર્લિલ માનવલવને સર્કણ બનાવે એ જ શુલ્કેચ્છા !

॥ શિવમાતુ સર્વ જગત ॥

સાચો સાધક જીવવાની આશ અને ભરણનો ભય એ અનેથી સર્વથા મુક્ત હોય છે.

અધર્મ કરનારા આત્માચો સુર્ધ રહે એ સારું છે, પણ ધર્મપરાયણ આત્માચો જગતા રહે એ સારું છે. — શ્રી ભગવતી સૂત્ર

* શ્રી આર્ય કલ્યાણોત્તમ સ્મૃતિ ગ્રંથ *